

	અથવા																													
પ્ર.-૨	<p>દલપત લિમિટેડ પડતર વત્તા ના પ્રમાણે કીમત નિર્ધારણ કરે છે. બધા શીરોપારી ખર્ચો, સીધી મજૂરી ના આધારે કુલ પડતર નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે વેચાણ કીમત નક્કી કરવામાં આવે છે. નીચેના આકડા તેમના વાર્ષિક બજેટ ૨૦૧૮ માંથી લેવામાં આવેલ છે.</p> <table border="1"> <tr> <th>વેચાણ</th> <th>(રૂ.)</th> </tr> <tr> <td>પ્રત્યક્ષ માલસામાન</td> <td>૧૦,૦૦,૦૦૦</td> </tr> <tr> <td>પ્રત્યક્ષ મજૂરી</td> <td>૧,૮૦,૦૦૦</td> </tr> <tr> <td>કેક્ટરી સુપ્રિટેન્ડેન્ટ નો પગાર</td> <td>૩,૨૦,૦૦૦</td> </tr> <tr> <td>વેચાણ પર કમિસન ચૂકવ્યું (૫%)</td> <td>૩૦,૦૦૦</td> </tr> <tr> <td>ફોરમેન નો પગાર</td> <td>૫૦,૦૦૦</td> </tr> <tr> <td>વીમો</td> <td>૬૦,૦૦૦</td> </tr> <tr> <td>જાહેરાત</td> <td>૧૦,૦૦૦</td> </tr> <tr> <td>મિલકતો પર ધસારો</td> <td>૨૦,૦૦૦</td> </tr> <tr> <td>વહીવટી ખર્ચાઓ</td> <td>૩૦,૦૦૦</td> </tr> <tr> <td>કારખાના ચલિત ખર્ચાઓ</td> <td>૭૦,૦૦૦</td> </tr> <tr> <td>સમારકામ અને જાળવણી ખર્ચાઓ</td> <td>૬૦,૦૦૦</td> </tr> <tr> <td>સાધનો વપરાશ</td> <td>૪૦,૦૦૦</td> </tr> <tr> <td>પરચુરણ પુરવઠો</td> <td>૧૦,૦૦૦</td> </tr> </table> <p>મોટા ઓર્ડર માટે કંપનીએ રૂ. ૧૦,૦૦૦ નું ટેન્ડર ભર્યું હતું કે જેમાં માલસામાન ખર્ચ રૂ. ૧,૮૦૦ અને પ્રત્યક્ષ મજૂરી રૂ. ૩,૨૦૦ થશે. ગ્રાહકે લઈલો અથવા છોડી દો'ના ધોરણે રૂ. ૮,૮૦૦ ની કિમત જણાવેલ, જો કંપની ઓર્ડર સ્વીકારે તો વર્ષ ૨૦૧૮ નું કુલ વેચાણ રૂ. ૧૦,૦૮,૮૦૦ થાય. દલપત લી. આ ઓર્ડર સ્વીકારવા માટે અચકાય છે કારણ કે તે કંપની પડતર કરતાં ઓછા ભાવે નહિ સ્વીકારવાની નીતિ ની વિરુદ્ધ છે.</p> <p>મેનેજિંગ ડિરેક્ટરે ઓર્ડર સ્વીકારવા અંગે ગણતરી સાથે નોંધ લખ્યો. ઉપરાંત કંપનીની કિમત નિતધારણ ની નીતિ પર પણ ટિપ્પણી કરો.</p>	વેચાણ	(રૂ.)	પ્રત્યક્ષ માલસામાન	૧૦,૦૦,૦૦૦	પ્રત્યક્ષ મજૂરી	૧,૮૦,૦૦૦	કેક્ટરી સુપ્રિટેન્ડેન્ટ નો પગાર	૩,૨૦,૦૦૦	વેચાણ પર કમિસન ચૂકવ્યું (૫%)	૩૦,૦૦૦	ફોરમેન નો પગાર	૫૦,૦૦૦	વીમો	૬૦,૦૦૦	જાહેરાત	૧૦,૦૦૦	મિલકતો પર ધસારો	૨૦,૦૦૦	વહીવટી ખર્ચાઓ	૩૦,૦૦૦	કારખાના ચલિત ખર્ચાઓ	૭૦,૦૦૦	સમારકામ અને જાળવણી ખર્ચાઓ	૬૦,૦૦૦	સાધનો વપરાશ	૪૦,૦૦૦	પરચુરણ પુરવઠો	૧૦,૦૦૦	(૧૮)
વેચાણ	(રૂ.)																													
પ્રત્યક્ષ માલસામાન	૧૦,૦૦,૦૦૦																													
પ્રત્યક્ષ મજૂરી	૧,૮૦,૦૦૦																													
કેક્ટરી સુપ્રિટેન્ડેન્ટ નો પગાર	૩,૨૦,૦૦૦																													
વેચાણ પર કમિસન ચૂકવ્યું (૫%)	૩૦,૦૦૦																													
ફોરમેન નો પગાર	૫૦,૦૦૦																													
વીમો	૬૦,૦૦૦																													
જાહેરાત	૧૦,૦૦૦																													
મિલકતો પર ધસારો	૨૦,૦૦૦																													
વહીવટી ખર્ચાઓ	૩૦,૦૦૦																													
કારખાના ચલિત ખર્ચાઓ	૭૦,૦૦૦																													
સમારકામ અને જાળવણી ખર્ચાઓ	૬૦,૦૦૦																													
સાધનો વપરાશ	૪૦,૦૦૦																													
પરચુરણ પુરવઠો	૧૦,૦૦૦																													
	વિભાગ-૨																													
પ્ર.-૩	સામાજિક હિસાબી પદ્ધતિ નો ખ્યાલ સ્પષ્ટ કરો અને સામાજિક હિસાબી પદ્ધતિ ની જરૂરિયાતો અને હેતુ ઓ વિષે નોંધ લખો.	(૧૭)																												
	OR																													
પ્ર.-૩	સામાજિક હિસાબી પદ્ધતિ ના અભિગમો વિશે વિગતવાર સમજાવો.																													
પ્ર.-૪	નોંધ લખો : (કોઈપણ બે)	(૧૭)																												
	(અ) કાર્બન કેડિટ	(૧૮)																												
	(બ) પર્યાવરણીય હિસાબી પદ્ધતિ ની સમસ્યાઓ.																													
	(ક) પર્યાવરણીય ઓડિટ																													
	(ડ) ક્યોટો પ્રોટોકોલ અને ઝોબલ વોર્મિંગ																													